



GUJARAT STATE FERTILIZERS & CHEMICALS LIMITED

Fertilizernagar - 391 750. Vadodara, Gujarat, INDIA.

CIN : L99999GJ1962PLC001121

NO.SEC/SE/ 2024

22nd March, 2024

The Corporate Relationship Department
BSE Limited
1st Floor, New Trading Ring
Rotunda Bldg., P.J.Towers, Dalal Street
Fort, MUMBAI - 400 001
SCRIP CODE: **500690**

The Manager, Listing Department
National Stock Exchange of India Ltd.
'Exchange Plaza', C/1, Block G
Bandra-Kurla Complex
Bandra (East), MUMBAI - 400 051
SYMBOL: **GSFC**

Dear Sir / Madam,

Sub: Newspaper Publication - Notice of Postal Ballot

Ref: Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper clippings published today, in the following newspapers:

1. Business Standard (English Edition); and
2. Loksatta Jansatta (Vadodara Edition).

The newspaper publication is also disseminated on Company's website at www.gsfclimited.com.

Kindly take the above on record.

Thanking you,

Yours faithfully,

For Gujarat State Fertilizers & Chemicals Limited

Nidhi Pillai

Company Secretary &

Vice President (Legal)

Membership No.: A15142

E-mail : investors@gsfc ltd.com

Encl : As above

Ph. : (O) +91-265-2242451, 2242651, 2242751, 2242641

Fax : +91-265-2240966 - 2240119 • Email : ho@gsfc ltd.com • Website : www.gsfc limited.com

ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company



Public Notice For Title Clearance
 Prathviraj Shankar Pojary and Chetna Prathviraj Pojary (Proposed Owner) has represented before me that Shashikanth Sakaral Gandhi is absolute owner of the immovable property mentioned in Schedule-A hereunder written. That it has been further represented before me that the original Registration Fee Receipt of the Sale Deed vide registration No: 6191 Dated:-26.04.2012 has been Misplaced. Any person or persons/ society/ institution, in possession thereof or claiming any right title, interest, claim, charge, lien or mortgage, whatsoever are notified to inform us about the same, with documentary evidence, within 7 days hereof. Failing which it shall be deemed that no person/ institutions any charge/ encumbrance/ claim over the said property or any part thereof and also deemed that charge/ encumbrance/ claim, if any, have been waived; and; thereafter no dispute shall not be valid/ entertained, which may be noted.

Schedule-A
 All that piece and parcel of the immovable property bearing Flat No. B/304 admeasuring about 1271.00 sq. ft. (Super built-up), 769.88 Square Feet i.e. 71.52 Square Meters (Builtup Area) on the 3rd floor of the Building No. 'B' of the building known and named as "Garden Valley" along with undivided proportionate share in the land underneath the said building constructed on the land of Final Plot No. 24 of T. P. Scheme No. 31 (Adajan) (Revenue Survey Nos. 699 paikae 1, 699 paikae 3, 699 paikae 4 and 699 paikae 5 of Moje: Village: Adajan) within City: Surat; Taluka: Surat City, District: Surat.

Office: 311, Annapolis, Parle Point, Surat-395007.
 Phone: 97140 60600, 76219 79564 (Dtd. 21.03.2024)

Shreyash Desai (Advocate)

STATE BANK OF INDIA
 RACPC-1, 2nd Floor, State Bank Bhavan, Opp. Panjarapole, Ghod Dod Road, Surat
 E-mail - sbi.10001@sbi.co.in

Notice u/s 13(2) of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002
 Dear Sirs, (1) Mrs. Soni Varsha Shyam Sunder (Borrower) & (2) Mrs. Neha Shyam Sunder Soni (Co-Borrower) Both at: Property Add: Plot No. 307, "Rameshwaram Park", Nr. Murla Lake City, Moje: Ansnab, Taluka: Olpad, Dist: Surat-394540, & Residence Address: Plot No: 90, Skyline Villa, Nr. Orbit School, Atodara Chokdi, Olpad-Sayan Road, Surat - 394130. Availed Credit Facilities from State Bank of India, Bhatha Branch (02636), SURAT. The Credit facilities are secured by mortgage of the following assets:

Description of Property
 All the pieces and parcel of Property bearing As per Site Plot No - 307, as per passing plan Plot No 291 "RameshwaramPark", Block No. 125/E/1 (KJP New Block No. 125/E/1-291), Near Murla Lake City, Moje: Ansnab, Taluka: Olpad, Dist: Surat- 394540. Admeasuring plot area 60.34Sq. mtrs and as per passing plan 56.30 sq. mtrs. along with undivided proportionate share in COP & Road Rasta Land area 36.53 Sq. mtrs and construction madethereon Ground Floor admeasuring about area 57.43 Sq. mtrs.

You created mortgage of the above property, as you failed to adhere to the terms of the sanction (1) Housing Term Loan Ac No 40166166323 (Sanctioned Limit Rs.16,20,000/-) & (2) Insta Home Top Up Loan A/C No. 41491013480 (Sanctioned Limit Rs.1,29,000/-) & (3) Home Suraksha Loan A/C No. 40521163341 (Sanctioned Limit Rs.87,000/-) the account is now irregular and the debt has been classified as Non-performing asset on 15/03/2024, in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India consequent to the default committed by you in repayment of principal debt and interest thereon. Therefore, the bank hereby calls upon you u/s 13(2) of the SARFAESI Act, 2002 by issuing this Demand Notice No.RACPC/SURAT/33-4-84/40166166323-41491013480-40521163341 dated 16/03/2024 as the notice sent to above mentioned address was returned undelivered. Your outstanding liabilities (in aggregate) due and owing to the bank is sum of (1) Rs.16,39,643/- (Rupees Sixteen Lakh Thirty-Nine Thousand Six Hundred Forty-Three Only) in Home Loan A/C No: 40166166323, (2) Rs.1,21,831/- (Rupees One Lakh Twenty-One Thousand Eight Hundred Thirty-One Only) in Insta Home Top up Loan Ac No: 41491013480 & (3) Rs.8,835/- (Rupees Eight Thousand Eight Hundred Thirty Five Only) in the Home Suraksha Loan Ac No: 40521163341 Total of above loan is Rs.17,70,309/- (Rupees Seventeen Lakh Seventy Thousand Three Hundred Nine Only) as on 16.03.2024, plus an applied interest w.e.f 17.03.2024 and unrealized interest with further interest and incidental expenses, costs etc. within 60 days from the date of this notice falling which the undersigned may be constrained to initiate action under the said act to enforce the aforesaid securities.

Date: 16/03/2024
 Place: Surat
 Sd/- Authorized Officer & Chief Manager, State Bank of India, RACPC SURAT.

Indian Bank - Sayajigunj Branch
 Chavans Bungalow Opp World Trade Centre Baroda, Sayajigunj, Vadodara-390005.

APPENDIX-IV (Rule-8(1)) POSSESSION NOTICE (For Immovable Property)
 Whereas the undersigned being the authorized officer of the SAYAJIGUNJ BRANCH under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the borrower Mrs Alkaben Bhaveshkumar Desai and Mr Bhaveshkumar Hakumraty Desai to repay the amount mentioned in the notice being Rs. 15,29,835/- (Rupees Fifteen lakhs Twenty Nine Thousand Eight Hundred Thirty Five only) with interest as mentioned in notice, within 60 days from the date of receipt of the said Notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of Act read with rule 8 of the security interest Enforcement Rules 2002 on this 20th March of the year 2024.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Indian Bank for an amount Rs. 15,29,835/- (Rupees Fifteen lakhs Twenty Nine Thousand Eight Hundred Thirty Five only) and interest thereon.

"The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

DESCRIPTION OF IMMOVABLE PROPERTY
 All that piece and parcel of residential house situated at B 201, Green Homes, Near Sai Chowdki, Behind Omkara Complex, Manjalpur, Vadodara 390011. Bounded: East: Open Sky Space & Common Passage, West: Open Sky Space, North: Flat B 202, South: Open Sky Space.

Date: 22.03.2024
 Place: Vadodara
 Authorised Officer
 Indian Bank

पंजाब नैशनल बैंक Punjab National Bank
 Circle SASTRa Centre Surat
 1st Floor, Meghani Tower, Station Road, Surat, 395003 Ph. : 0261-2454543 email: cs8323@pnb.co.in

Appendix-IV [See Rule 8(1)] POSSESSION NOTICE (For Immovable Property)
 Whereas, the undersigned being the Authorised Officer of the Punjab National Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred under Section 13(12) read with [rule 3] of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 25.07.2023 calling upon the borrowers/mortgagor Mr. Vinubhai Jinabhai Dobariya (Borrower), Mrs. Kantaben Vinubhai Dobariya (Co-Borrower) and Mr. Vijaykumar D Vasani (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 34,70,815.40 (Rupees Thirty-four Lacs Seventy Thousand Eight Hundred Fifteen and Paise Forty Only) as on 30.06.2023 and further interest with monthly rest and other charges and expenses within 60 days from the date of notice/date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 20th day of March of the year 2024.

The Borrowers/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an aggregate amount of Rs. 34,70,815.40 (Rupees Thirty-four Lacs Seventy Thousand Eight Hundred Fifteen and Paise Forty Only) as on 30.06.2023 and further interest thereon.

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured asset.

Description of Immovable Property
 All that right and interest in the property bearing plot no 25 (As per passing plan Plot No. D/25) admeasuring 88.84 sq.yards. i.e. 74.87 Sq.mtrs. (as per passing plan admeasuring 55.28 sq.mtrs.) of "Shakti Lake City Vihag-C" situated at Revenue Survey No. 94, 95 & 96, Block No.92 at moje Nansad, Sub Dist Kamrej Dist Surat in the name of Mr. Vinubhai Jinabhai Dobariya Bounded: North: Plot No. 24, East: Adj. Plot No. 26, South: Society Road, West: Society Road.

Date: 20-03-2024
 Place: Surat
 Authorised Officer,
 Punjab National Bank

ICICI Bank
 Branch Office: ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat- 395002.

PUBLIC NOTICE
 Authorised Officer of ICICI Bank hereby inform that scheduled auction Published on 7th March 2024, page No. 15 in Business Standards, to be held for the immovable Asset under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 stand cancelled until further notice. The list of auctions that are postponed are given hereunder:

Sr. No.	Name of Borrower(s)/ Co Borrowers/ Guarantors	Details of the Secured asset(s) with known encumbrances, if any	Scheduled Date & Time of Auction
1.	Nilesh Popatbhai Golakiya (Borrower) Popatbhai Golakiya (Co Borrower) LBSUR00004900683	Shop No. 320, Third Floor, Crystal Plaza, F.P. No. 130, T.P. S No 20, Original Plot Bhavnabhai Golakiya (Co Borrower) Survey No. 177 of Mouje Puna. Ta.: Puna Dist.: Surat-395006. Admeasuring an built up area 18.03 sqmt & carpet area is 16.97 sqmt	March 28, 2024 From 11:00 AM Onwards

Date: March 22, 2024
 Place: Surat
 Sd/- Authorized Officer
 ICICI Bank Limited

OSBI Retail Asset Central Processing Center, 2nd Floor, State Bank Bhavan, Opp Panjara Pole, Nr BSNL office, Ghod Dod Road, Surat-395002. Phone: (0261) 2244501-502-503

POSSESSION NOTICE (For Immovable Property)
 Whereas, the undersigned being the Authorized Officer of the State Bank of India (RACPC) Surat, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated: 22/11/2023 Calling (1) Mrs. Chandani Ranjukumar Gupta a borrower (2) Mr. Ranjukumar Baijnath Gupta as the Co-borrowers to repay the outstanding amount mentioned in the notice being Rs.8,81,719/- (Rupees Eight Lacs Eighty One Thousand Seven Hundred Nineteen Only) along with interest, penal interest, charges, costs etc. within 60 days from the date of receipt of the said notice.

The borrower, having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-Borrower/ Guarantor and public in general, that the undersigned has taken physical possession of the property described herein view of order dated 20th February, 2024 passed by the 19th Additional Sr. Civil Judge & Add. Chief Judicial Magistrate, Surat, in Case No. CRMA/J/2013/2024 through the Court Commissioner and the said Court Commissioner handed over the physical possession to the undersigned Authorized Officer on this 19/03/2024.

The Borrower/Guarantor in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the State Bank of India (RACPC) Surat for an amount of being Rs.8,81,719/- (Rupees Eight Lacs Eighty One Thousand Seven Hundred Nineteen Only) along with interest, penal interest, charges, costs etc. from Notice 22/11/2023. The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description Of The Immovable Property
 All that piece and parcel of the property being Flat No. 207, on the 2nd Floor of Building No.: B admeasuring Super built up area 34.93 Sq.mtrs., and Built up area 25.752 Sq. mtrs. undivided proportionate share in the land in C.O.P & Road, premises known as "Chaitanya Park Flats" Situated on the land bearing Gram Panchayat House No. 365 & 361 paikae Sheet No. 84 & Chalta No. 71, Tenement No. 17B-79-5135-0-001 in R.S. No. 71 of Village: Adajan, Sub-Dist.: Surat City, District: Surat.

Hypothecation:
 Hypothecation properties viz. Current Assets including Stock-in-Trade, Stock in Trade Receivables Consumable Stores and Hypothecation Movable Plant and Machinery etc. Mentioned in the documents.

Date: 19/03/2024
 Place: Surat
 Authorised Officer & Chief Manager
 State Bank of India, Surat.

STATE BANK OF INDIA
 RACPC-1, 2nd Floor, State Bank Bhavan, Opp. Panjarapole, Ghod Dod Road, Surat
 E-mail - sbi.10001@sbi.co.in

Notice u/s 13(2) of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002
 Dear Sirs, (1) Mrs. Alka Patil (Borrower), (2) Mr. Nandlal Prabhakar Patil (Co-Borrower), (3) Mr. Manoj Prabhakar Patil (Co-Borrower) & (4) Mr. Prabhakar Dalapat Patil (Co-Borrower) All At: Plot No: 115, Gokuldham Sai Palace, Nr Gomansingh Row House, B/H Kharwasa Road, Village - Saniya Kande, Surat - 394210. Availed Credit Facilities from State Bank of India, Dindoli Branch (18159), SURAT. The Credit facilities are secured by mortgage of the following assets:

Description of Property
 All the pieces and parcel of Property bearing Plot No.115, "Gokuldham Sai Palace". R.Survey No. 173/1, Block No. 190/2, Situated at Village: Saniya Kande, Sub-District - Choryasi, Dist: Surat. Admeasuring land area 45.75 Sq. mtrs and other undivided proportionate share in land, Road and COP area of 24.94 Sq. mtrs.

You created mortgage of the above property, as you failed to adhere to the terms of the sanction (1) Housing Term Loan A/C No. 39067585438 (Sanctioned Limit Rs.17,10,000/-) & (2) Home Top Up Loan A/C No. 39067744025 (Sanctioned Limit Rs.4,60,000/-) & (3) Home Suraksha Loan A/C No. 39075580382 (Sanctioned Limit Rs.87,000/-) the account is now irregular and the debt has been classified as Non-performing asset on 09/03/2024, in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India consequent to the default committed by you in repayment of principal debt and interest thereon. Therefore, the bank hereby calls upon you u/s 13(2) of the SARFAESI Act, 2002 by issuing this Demand Notice No. RACPC/SURAT/2-6-70/39067585438-39067744025-39075580382 dated 12/03/2024 as the notice sent to above mentioned address was returned undelivered. Your outstanding liabilities (in aggregate) due and owing to the bank is sum of (1) Rs.17,40,021/- (Rupees Seventeen Lakh Forty Thousand Twenty One Only) in Home Loan A/c No: 39067585438, (2) Rs.4,76,599/- (Rupees Four Lakh Seventy-Six Thousand Five Hundred Ninety Nine Only) in Home Top Up Loan Ac No: 39067744025 & (3) Rs.88,045/- (Rupees Eighty Eight Thousand Forty-Five Only) in Home Suraksha Loan Ac No: 39075580382. Total of above loan is Rs.23,04,665/- (Rupees Twenty-Three Lakh Four Thousand Six Hundred Sixty-Five Only) as on 12.03.2024, plus an applied interest w.e.f 13.03.2024 and unrealized interest with further interest and incidental expenses, costs etc. within 60 days from the date of this notice falling which the undersigned may be constrained to initiate action under the said act to enforce the aforesaid securities.

Date: 12/03/2024
 Place: Surat
 Sd/- Authorized Officer & Chief Manager,
 State Bank of India, RACPC SURAT.

Public Notice
 NOTICE is hereby given to public at large that the undersigned Advocate is investigating the title of (1) Mukesh Kishoribhai Patel, (2) Devendra Narshibhai Patel, (3) Daxesh Ratilal Patel, (4) Yashkumar Kuntesh Patel, who claims to joint owners and occupiers of below mentioned schedule properties and are resident of Vadodara. All persons having or claiming any right, title, demand, claim or estate interest in respect of the said property or to any part thereof by way of sale, exchange, mortgage, let, lease, lien, charge, maintenance, license, gift, inheritance, share, possession, easement, trust, bequest possession, tenancy, assignment or encumbrance of whatsoever nature or otherwise are hereby requested to intimate to the undersigned in writing at the address mentioned below of any such claim accompanied with all necessary and supporting documents within 14 days from the date of publication hereof, failing which it shall be presumed that there are no claims and that claims, if any, have been waived off and the undersigned shall proceed to issue a Title Certificate in respect of the same.

Schedule
 Reg. Dist: Vadodara, Sub Dist: Padra, in the sim of village Kanzat, bearing:

Sr.No	New Block/RS No.	Old Block No.	Adm HA-RA-SQ Mtr	Tenure
1	773	783	0-56-94	Old Tenure
2	774	784/A	0-11-37	Old Tenure
3	775	784/B	0-55-26	Old Tenure
4	777	785/A	2-17-19	Old Tenure
5	798	804/B	0-31-28	Old Tenure
6	799	805	1-45-05	Old Tenure
7	800	806	1-04-99	Old Tenure
8	801	807	3-44-86	Old Tenure

Place: Vadodara, Date: 22-3-2024
 Office in Vadodara, 3rd Floor, 315, Urban-2, Opp. Akshar Pavillion, Near Priya Talkies, Bhatiy, Vadodara-391410
 Mob.: 9825979300

Through us,
 Pulin Harendra Banatwala, Advocate
 Banatwala Advocates' Associate
 (Under Instructions)

GUJARAT STATE FERTILIZERS & CHEMICALS LIMITED
 CIN No. L99999GJ1962PLC001121
 Regd. Office: Fertilizernagar-391750, Dist: Vadodara, India
 Phone: (0) +91-265-2242651 Fax: +91-265-2240119
 Web: www.gsfcilimited.com • Email: ho@gsfcilt.com

NOTICE OF POSTAL BALLOT
 NOTICE is hereby given pursuant to Section 110 read with Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013, ("Act"), read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, ("Rules"), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), Secretarial Standard - 2 on General Meetings issued by The Institute of Company Secretaries of India ("SS-2") and other applicable laws, Rules, Regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force and as amended from time to time), and in accordance with the guidelines prescribed by the Ministry of Corporate Affairs ("MCA") for holding general meetings / conducting postal ballot through e-voting, vide General Circular No. 09/2023 dated 25th September, 2023 (in continuation to all other circulars issued earlier in this regard), the SEBI vide circular no. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated 7th October 2023, approval of the Members of Gujarat State Fertilizers & Chemicals Limited is sought for the following proposal contained in the resolution forming part of the Postal Ballot Notice ("Notice") dated 18th March, 2024, through electronic voting ("e-voting") only.

Special Business
 Appointment of Shri Kamal Dayani, IAS (DIN:05351774) as Managing Director of the Company. (Ordinary Resolution).

Members are hereby informed that:

- The Company has sent Notice only through email to the Members on Thursday, 21st March, 2024 to those members whose email address are registered with the Company / Depository Participant / Registrar & Transfer agent and whose names are recorded in the Register of Members/ Beneficial Owners as on the cut-off date i.e. Friday, 15th March 2024. In compliance with the MCA Circulars, hard copies of Notice, Postal Ballot Form and prepaid business reply envelope have not been sent to the Members. Hence, the Members are required to communicate their assent or dissent only through the remote e-voting system.
- The Company has engaged the services of Central Depository Services (India) Limited ("CDSL") for the purpose of providing remote e-voting facility to the Members. This Notice is available on the website of the Company at www.gsfcilimited.com, on the website of Stock Exchanges at www.nseindia.com and www.bseindia.com and on the website of CDSL at www.evotingindia.com. A person who is not a Shareholder as on the Cut-off date should treat this Postal Ballot notice for information purpose only. The e-voting facility will be available during the following period:

Commencement of e-voting:	Friday, 22 nd March, 2024 at 9:00 a.m. (IST)
End of e-voting:	Saturday, 20 th April, 2024 at 5:00 p.m. (IST)
Cut-off date for eligibility to vote	Friday, 15 th March, 2024

- The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be forthwith disabled by CDSL upon expiry of the aforesaid period.
- The detailed procedure / instructions on the process of remote e-voting are specified in the Notice which is available on the website of the Company at www.gsfcilimited.com, on the website of Stock Exchanges at www.nseindia.com and www.bseindia.com and on the website of CDSL at www.evotingindia.com.
- Members holding shares in physical form can update / register their PAN, Nomination, Contact Details i.e. Postal address with PIN, Mobile number, E-mail address, Bank Account details (for receiving the dividend, if any, directly in their Bank Accounts through electronic mode) and Specimen Signature by providing form ISR-1, ISR-2, ISR-3 / form SH-13 complete in all respects along with other required documents as prescribed in these forms by any one of the following mode:-
 - Sending hard copy of the said forms along with required documents to our RTA, Link Intime India Private Limited, Unit: Gujarat State Fertilizers and Chemicals Limited, C-101, 247 Park, L.B.S Marg, Vikhroli (West), Mumbai - 400083; or
 - In person verification (IPV) of the said forms and required documents at the office of our RTA, Link Intime India Private Limited at B-102 & 103, Shangrila Complex, First Floor, Opp. HDFC Bank, Near Radha Krishna Char Rasta, Akota, Vadodara - 390 020; or
 - Through electronic mode, by downloading and filling the said forms with e-sign. The required documents should be upload at the website of the RTA of the Company at <https://web.linkintime.co.in/KYC/index.html> Procedure for uploading the documents is also available at the said link.
- Members who hold shares in dematerialized form can register / update their KYC details including E-mail address and Bank Account details with their Depository Participants (DP) where they have their demat account by complying the requisite formalities of their DP. Members holding shares in physical mode and who have not updated their email addresses are requested to update their email addresses with the Company's RTA by writing at www.linkintimeindia.com along with the copy of the signed request letter mentioning the name and address of the Member, self-attested copy of the Income-Tax PAN card, and self-attested copy of any document (eg. Driving License, Election Identity Card, Passport) in support of the address of the Member. Members holding shares in dematerialized mode are requested to register / update their email addresses with the relevant Depository Participants. In case of any queries / difficulties in registering the e-mail address, Members may also write to: investors@gsfcilt.com.
- The Company has appointed Shri Niraj Trivedi, Practising Company Secretary (FCS 3844 and CP No.3123) to act as the Scrutinizer, to scrutinize the entire e-voting process in a fair and transparent manner.
- The Results of Postal Ballot shall be declared by Tuesday, 23rd April, 2024. The results along with the Scrutinizer's Report shall be placed on the Company's website at www.gsfcilimited.com, on the website of Stock Exchanges at www.nseindia.com and www.bseindia.com and on the website of CDSL at www.evotingindia.com.
- In case of any query on e-voting, members may contact to Mr. Nitin Kunder (022-23058738) or Mr. Bhavesh Pimpulkar (022-23058543) or Mr. Rakesh Dalvi (022-23058542) (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 at designated email ID: helpdesk.evoting@cdslindia.com or call on 1800 222 55 33.

For Gujarat State Fertilizers & Chemicals Limited
 Sd/-
 Nidhi Pillai
 Place: Vadodara
 Date: 21st March 2024
 Company Secretary & Vice President (Legal)

Bank of India
 6th Floor, Bank Of India Building, Bhadra, Ahmedabad, Phone: 079-66122528, 66122530

POSSESSION NOTICE (For Immovable Properties)
 The undersigned being the Authorized Officer of the Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notices on the under noted names in respect of various loan / Financial Assistance under its credit facilities, calling upon the respective borrowers / guarantors to repay the amount mentioned in the notices being further interest thereon within 60 days from the date of receipt of the said notices. The respective borrowers / guarantors having failed to repay the amount, notice is hereby given to the borrowers / guarantors and the public in general that the undersigned has taken Possession of the properties described herein below on each account in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules and on this below mentioned date. The respective borrowers / guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealing with the properties will be subject to charge of Bank of India, Ahmedabad for the amounts and with further interest thereon till the date of payment and incidental expenses, costs, charges thereon mentioned against each accounts herein below. The respective borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Name of Borrowers & Guarantors & Branch Name	Demand Notice Date / Outstanding Amount (Rs.)	Description of Immovable Properties	Date / Type of Possession
1	M/s. Uma Industries, Proprietor: Mr. Alpeshbhai Govindbhai Patel Branch: New Cloth Market	10.06.2019 Rs. 46,26,969.70/- (Rupees Forty Six Lacs Twenty Six Thousand Nine Hundred Sixty Nine and Seventy Paise Only)	All that part and parcel of the movable property owned by Uma industries being stock and Machineries lying in the shed No 146, Tribhuvan Industrial Estate, Kathwada, Ahmedabad-382430.	17.03.2024 Physical Possession
2	Mr. Ajaykumar Arvindbhai Solanki (Mortgagor & Borrower) & Mr. Mayur Arvindbhai Solanki (Co-Mortgagor & Co-Borrower) Branch: Bopal	29.11.2023 Rs. 24,56,454.14/- (Rupees Twenty Four Lacs Fifty Six Thousand Four Hundred Fifty Four and Fourteen Paise Only)	All that part and parcel of Equitable Mortgage of Immovable Property situated at Unit No. as under: Equitable Mortgage of Flat No. B-203 on 2nd Floor, Block B, Shrinand Residency admeasuring 71.56 Sq. Mtr together with undivided share of land admeasuring 25.86 Sq. Mtr. situated at RS No. 558/1, TPS No. 107, FP No. 24/1, Moje: Ramol, Taluka: Vatva, Dis. Ahmedabad - 382449 within the state of Gujarat. North: Road, South: Passage then Flat No. B-202, East: Flat No. B-204, West: Road.	16.03.2024 Symbolic Possession

Date: 16.03.2024 & 17.03.2024, Place: Ahmedabad
 Sd/- Authorised Officer, Bank of India

Bombay Market Branch Surat :- Banking Block-1, Bombay Market, Umarwada, Surat-395010
 Phone: 0261-2341117-2342041
 Email: BombayMarket.Vadodara@bankofindia.co.in

POSSESSION NOTICE(Symbolic)
 The undersigned being the authorized officer of the Bank of India, Bombay Market Branch, Surat under the securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 25.05.2023 calling upon the borrower(s)/Guarantor(s) 1. M/s Jigar Tex 2. Shri Ramesh Narandas Patel (Proprietor), to repay the amount mentioned in the notice being Rs.10,24,441.14 (Rupees Ten Lakh Twenty-Four Thousand Four Hundred Forty-One and Fourteen Paise) (Contractual dues up to the date of notice) with further interest thereon @ applicable rate of interest compounded with monthly rests and all costs, charges and expenses incurred by Bank till repayment within 60 days from the date of the receipt of the said notice.

The borrower(s)/Guarantor(s) having failed to repay the amount, notice is hereby given to the borrower(s)/Guarantor(s) and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub section (4) of section 13 of Act read with rule 8 of the Security interest Enforcement Rules, 2002 on this 16th day of March, 2024.

The borrower(s)/Guarantor(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of Bank of India, Bombay Market Branch, Surat for an amount of Rs.10,24,441.14 (Rupees Ten Lakh Twenty Four Thousand Four Hundred Forty One and Fourteen Paise) (Contractual dues up to the date of notice) with further interest thereon @ applicable rate of interest compounded with monthly rests and all costs, charges and expenses incurred by Bank till repayment.

The borrowers/Guarantors attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower(s) and the guarantor(s) will be required to hand over the actual and vacant possession of the property mentioned hereunder as and when demanded by the Authorized Officer.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
 All that Part and Parcel of the stock of raw material viz. Yarn and finished goods viz. grey cloth situated at Survey No.171, Plot No.97 Vishal Industrial Society, Udhana-Magadala Road, Surat-395002 within the limit of Surat City Owned By: M/s Jigar Tex (Proprietorship Concern) Shri Ramesh Narandas Patel. Bounded As under: NA.

Date: 16.03.2024
 Place: Surat
 Authorised Officer, Bank of India,
 Bombay Market Branch, Surat

Bank of Baroda
 Ring Road Vastral Branch : Shop No. 7-12, Pushp Business Campus, SP Ring Road, Vastral, Ahmedabad-382418. Tele : 9687631248, Email: dvast@bankofbaroda.com

Sale Notice (30 DAYS) For Sale of Immovable Properties
 APPENDIX-IVA [See proviso to Rule 8(6) & 6(2)]"

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6(2) & (8) of the Security Interest (Enforcement) Rules, 2002.
 Notice is hereby given to the public in general and in particular to the Borrower (s), Mortgagor (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, Possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower/s/Mortgagor/s/Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below

Sr. No.	Name & address of Borrowers / Guarantor / Mortgagor s	Give short description of the immovable property with known encumbrances, if any	Dues, As per Demand notice (Less Recovery made after issuance of 13(2) demand notice) Plus interest there on	1. Reserve Price 2. Earnest Money Deposit (EMD) 3. Bid Increase Amount
1	Borrower (1) Mr. Rameshbhai Shantibhai Thakor (2) Mrs. Radhaben Rameshbhai Thakor Guarantor: Mr. Bharatbhai A Thakor	All that piece and parcel of immovable property bearing situated at Residential Flat No. M/102, 1st Floor, Known as "Devnandan Supremus", Nr. Galaxy Township, Opp. RKF Camp, SP Ring Road, Vastral, Ahmedabad situated on N.A. Land bearing Block No. 7 (R.S. No. 773/2) admeasuring about 27923 sq mtr. Having T.P. No. 114, Final Plot No. 30/2 admeasuring about 16750 sq mtr lying and being at Mouje Vastral, Ta City Ahmedabad, Dist. Ahmedabad, Sub-District- Ahmedabad-7 (Odhav). The said property is bounded as on under : On the East : Flat No. M/105, On the West : Society Road, On the North : By Flat No. M/101, On the South : By Flat No. M/103	Rs. 7,30,884.72 + legal charges + unapplied interest - less recovery thereafter	Reserve Price : 13.50 Lacs Earnest Money Deposit : 1.35 Lacs Bid increase Amount : 10,000/-

E-Auction Date : 03.05.2024 and E-Auction Time: 02:00 PM to 06:00 PM (unlimited extension of 10 minutes) • Status of Possession (Constructive / Physical) : Physical • Property inspection Date: 29.04.2024, Time : 11.00 Am to 2.00 PM (BY TAKING PRIOR APPOINTMENT)

For detailed terms and conditions of sale, please refer to the link provided in <https://www.bankofbaroda.in/e-auction.htm> and <https://ibapi.in>. Also, prospective bidders may contact the Branch Head Mr. Alpesh Parate : 9687631248 (GST/TDS as per Government Rules applicable shall be payable by purchaser on sale of M

